



DC-002-001404-N

Seat No. _____

B. Com. (Sem. IV) (CBCS) Examination

April / May – 2015

Income Tax : Paper - II (CORE)

Faculty Code : 002

Subject Code : 001404

Time : 2½ Hours]

[Total Marks : 70

- સૂચના : (1) પ્રશ્ન-1 M.C.Q. પ્રશ્નના જવાબ ઉત્તરવહીમાં આપવાનાં છે.
(2) કુલ પાંચ પ્રશ્નો રહેશે. બધા ફરજિયાત છે.
(3) જમણી બાજુના અંક ગુણ દર્શાવે છે.

1 M.C.Q. :

20

- (1) યંત્ર પર ઘસારો યંત્રની કઈ કિંમત પર ગણવો જોઈએ ?
(A) યંત્રની ઘટેલી બાકી પર (B) યંત્રની ખરીદ કિંમત પર
(C) યંત્રની બજાર કિંમત પર (D) ઉપરમાંથી એકેય નહીં
- (2) ધંધાની આવકમાંથી કયો ટેક્સ બાદ મળી શકે ?
(A) પ્રોફેશનલ વેરો (B) આવક વેરો
(C) સંપત્તિ વેરો (D) ઉપરમાંથી એકેય નહીં
- (3) અંગત વપરાશની વસ્તુમાં નીચેની મિલકતો પૈકી કઈ મિલકતનો સમાવેશ થતો નથી?
(A) સ્થાયી મિલકત (B) ડ્રોઈંગ્સ/ચિત્રો
(C) જ્વેલરી (D) ઉપરની તમામ વસ્તુઓ

- (4) નીચે દર્શાવેલ પૈકી કઈ મિલકતના હસ્તાંતરમાંથી મૂડી નફો ઉદ્ભવે છે ?
 (A) કોઈપણ મૂડી સ્વરૂપની મિલકત (B) કોઈપણ મિલકત
 (C) જમીન અને મકાન (D) શેર અને સ્ટોક
- (5) કંપનીના ઈક્વિટી શેર ખરીદાના કેટલા સમય પછી વેચવામાં આવે તો લાંબાગાળાનો મૂડી નફો પ્રાપ્ત થયો ગણાય ?
 (A) 12 માસ પછી (B) 18 માસ પછી
 (C) 24 માસ પછી (D) 36 માસ પછી
- (6) કંપની દ્વારા જાહેર કરાયેલ ડિવિડન્ડ
 (A) સંપૂર્ણપણે કરપાત્ર છે. (B) સંપૂર્ણ રીતે કરમુક્ત છે.
 (C) અંશતઃ કરપાત્ર છે. (D) કલમ 80L હેઠળ કપાતને પાત્ર છે.
- (7) જામીનગીરીઓના વેપારમાં રોકાયેલ કરદાતાની આવકમાં જામીનગીરીઓનું વ્યાજ કયા શીર્ષક હેઠળ ધ્યાનમાં લેવાશે ?
 (A) અન્ય સાધનોની આવક તરીકે
 (B) ધંધાની આવક તરીકે
 (C) મૂડી નફા તરીકે
 (D) ઉપરમાંથી એકેય નહીં
- (8) મકાન પેટાભાડે આપવાથી થતી આવક કયા શીર્ષક હેઠળ ધ્યાનમાં લેવાશે?
 (A) ધંધાની આવક તરીકે
 (B) અન્ય સાધનોની આવક તરીકે
 (C) મકાન મિલકતની આવક તરીકે
 (D) ઉપરમાંથી એકેય નહીં

- (9) લોટરીની રકમ ચૂકવતી વખતે નીચે મુજબ કરકપાત કરવાની રહે છે.
- (A) 30% વત્તા સરચાર્જ (B) 30%
- (C) 30% વત્તા શિક્ષણ ઉપકર (D) 31%
- (10) વ્યાજમાંથી કરકપાત કરનારે આકારણી વર્ષના એપ્રિલના અંત સુધીમાં સર્ટિફિકેટ નીચેની નિયત ફોર્મમાં કર્મચારીને આપવાનું રહે છે.
- (A) ફોર્મ નં. 15 (B) ફોર્મ નં. 16A
- (C) ફોર્મ નં. 16 (D) ફોર્મ નં. 26
- (11) ભારતીય નાગરિકને વ્યાજ ચૂકવતી વખતે કર ઉપરાંત નીચેનામાંથી કયો ચાર્જ/સેસ કપાત કરવાનો રહે છે ?
- (A) સરચાર્જ (B) ઉચ્ચતર શિક્ષણ ઉપકર
- (C) શિક્ષણ ઉપકર (D) એકેચ નહીં
- (12) સેવા કરની જોગવાઈઓના પ્રથમ વર્ષમાં કેટલી સેવાઓ ઉપર સેવા કર લાદવામાં આવેલ હતો ?
- (A) શૂન્ય (B) 1
- (C) 2 (D) 3
- (13) નીચેનામાંથી કયા કાર્યને સેવાકાર્યની વ્યાખ્યામાં ન લઈ શકાય ?
- (A) સ્ટોક બ્રોકર (B) ટેલિફોન સેવા
- (C) સામાન્ય વીમા કંપની (D) કરિયાણાની દુકાન
- (14) સર્વિસ ટેક્સ કયા પ્રકારનો ટેક્સ છે ?
- (A) પ્રત્યક્ષ કરવેરા (B) પરોક્ષ કરવેરા
- (C) ઉપરોક્ત બંને (D) આમાંથી એકપણ નહીં

- (15) 1978નો સૂચકઆંક કેટલો માનવામાં આવે છે ?
- (A) 80 (B) 90
(C) 100 (D) 711
- (16) ટી.ડી.એસ.નું પૂરું નામ
- (A) ટેક્સ રિડક્શન એન્ડ સોર્સ (B) ટેક્સ રિડક્શન એટ સેલેરી
(C) ટેક્સ રિડક્શન એટ સોર્સ (D) ટેક્સ રિટેક્ટેડ એટ સોર્સ
- (17) નીચેનામાંથી કઈ રકમ ધંધા વ્યવસાયની આવકમાંથી બાદ મળી શકે નહીં ?
- (A) લોન પરનું વ્યાજ
(B) મિલકત ખરીદવા લીધેલ લોનનું વ્યાજ
(C) મૂડી પરનું વ્યાજ
(D) મિત્ર પાસેથી લીધેલ લોનનું વ્યાજ
- (18) નીચે દર્શાવેલ પૈકી કઈ મિલકતના હસ્તાંતરમાંથી મૂડી નફો ઉદ્ભવતો નથી ?
- (A) રહેઠાણનું મકાન (B) શેર
(C) બોન્ડ્સ (D) મોટરકાર
- (19) પ્રથમ વર્ષમાં સર્વિસ ટેક્સ કેટલા ટકા લેવામાં આવેલ હતો ?
- (A) 8% (B) 10%
(C) 12% (D) 5%
- (20) માન્ય સંસ્થાને આપેલ દાન ધંધા-વ્યવસાયના ખર્ચ તરીકે કેટલા ટકા બાદ મળે ?
- (A) 30% (B) 50%
(C) 100% (D) બાદ ન મળે

- 2 શ્રી રાજેશ રાજકોટના એક જાણીતા એડવોકેટ છે. તેઓ પોતાના ચોપડા રોકડ 15 પદ્ધતિએ રાખે છે. તેમના 31-3-2014ના રોજ પૂરા થતાં પાછલા વર્ષની નીચેની માહિતી પૂરી પાડે છે :

આવક-જાવક ખાતું

આવક	રકમ રૂ.	જાવક	રકમ રૂ.
બા.આ.લા.	11,200	ઓફિસનાં સાધનોની ખરીદી	24,000
અસીલો પાસેથી ફી		મોટરકારના ખર્ચા	4,800
2011-12	500	ઓફિસ ખર્ચા	26,200
2012-13	1000	કર્મચારીઓનો પગાર	45,100
2013-14	1,05,000	ચૂકવેલ આવકવેરા	6,500
અસીલો તરફથી મળેલ ભેટ	800	લોન પર વ્યાજ	1,100
અસીલો પાસેથી લોન	11,000	પ્રોવિડન્ટ ફંડમાં ફાળો	650
		લોન પરત કરી	15,000
		બા.આ. લ. ગયા	6,150
	1,29,500		1,29,500

વધારાની માહિતી નીચે મુજબ છે :

- (1) મોટરકારનો ઘસારો રૂ. 1,500 ગણવાનો છે.
- (2) મોટરકારનો 20% ભાગ અંગત વપરાશ માટે થાય છે.
- (3) રૂ. 600ની ફી મળવાની બાકી છે.
- (4) ઓફિસનાં સાધનો અંગે 10% ઘસારો માંડી વાળવાનો છે.

આ.વ. 2014-15 માટેની ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી કરો.

અથવા

- 2 શ્રી મનીષ તલાટીએ તા. 31મી માર્ચ, 2014ના રોજ પૂરા થતાં વર્ષ માટેનું નફા-નુકસાન ખાતું નીચે પ્રમાણે તૈયાર કર્યું છે : 15

નફા-નુકસાન ખાતું

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
સામાન્ય ખર્ચાં	6,500	કાર્યો નફો	1,63,200
ઘાલખાધ	200	વટાવ અને કમિશન	600
ઘાલખાધ અનામત	500	ભાડાની આવક	2,700
કરવેરાની જોગવાઈ	5,700	પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ	300
આવક વેરો	8,500	ઘાલખાધ પરત	1,600
વીમા પ્રીમિયમ	800	શેર વેચાણ નફો (નેટ)	7,500
મોટરકાર ખર્ચ (ઘસારા સિવાય)	10,500	ચંત્ર વેચાણનો નફો (ઉપજ રૂ. 1,000)	100
વેચાણ વેરો	5,500		
સ્ટાફનો પગાર	68,500		
કાનૂની ખર્ચ	400		
માન્ય ધર્માદા ટ્રસ્ટને દાન	600		
ચોખ્ખો નફો	68,300		
	1,76,000		1,76,000

વધારાની માહિતી નીચે પ્રમાણે છે :

- (1) વીમા પ્રીમિયમમાં રૂ. 300 તબીબી વીમા પ્રીમિયમ તથા રૂ. 200 જીવન વીમા પ્રીમિયમના છે.
- (2) ઘાલખાધ પરતની રકમ પૈકી 25% રકમ ત્રણ વર્ષ અગાઉ નામંજૂર કરેલા ઘાલખાધ પૈકીની છે.
- (3) મોટરકારનો $\frac{1}{2}$ વપરાશ અંગત હેતુ માટે થાય છે. તા. 1-4-13ના રોજ મોટરકારની ઘસારાબાદ કિંમત રૂ. 25,000 હતી. (ઘસારાનો દર 15%) આકારણી વર્ષ 2014-15 માટે તેમની ધંધાની કુલ કરપાત્ર આવકની ગણતરી કરો.

- 3 નીચે આપેલી માહિતી પરથી શ્રી મહેશના આ.વ. 2014-15ના કરપાત્ર મૂડી નફાની ગણતરી કરો. (નાણાકીય વર્ષ 2013-14નો સૂચકાંક 939 છે.) 15

ક્રમ	ખરીદ તારીખ	વેચાણ કિંમત રૂ.	ફેરબદલીના ખર્ચા	ખરીદ કિંમત રૂ.	મિલકત અંગે માહિતી	ખરીદીનાં વર્ષનો સૂચક આંક
1	1-1-68	30,70,000	9,000	3,00,000	અંગત રહેઠાણનું મકાન (એકમાત્ર)	100
2	1-6-05	4,00,480	-	1,59,040	"R" લિ.ના શેરો	497
3	1-3-94	1,97,000	6,000	73,200	"A" લિ.ના શેરો	244
4	1-9-85	28,90,100	11,000	3,99,000	ઝવેરાત	133
5	1-1-13	—	—	2,02,000	અંગત રહેઠાણનું મકાન (નવું)	—

અંગત રહેઠાણનું જૂનું મકાન તા. 15-3-2014ના રોજ વેચેલ છે. વેચેલ અંગત રહેઠાણનાં મકાન તથા ઝવેરાતની તા. 1-4-81ના રોજની બજારકિંમત અનુક્રમે રૂ. 3,00,000 તથા રૂ. 1,80,000 હતી. 1-11-13ના રોજ બંને કંપનીઓના વેચેલ શેરો સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સને પાત્ર છે.

અથવા

- 3 શ્રી દિનેશની આવકની નીચે આપેલ વિગત પરથી આકારણી વર્ષ 2014-15 માટે તેમની મૂડીના નફાની કરપાત્ર આવકની ગણતરી કરો : 15

(1) તા. 1-4-2013ના રોજ તેમની અંગત માલિકીનું રહેઠાણનું મકાન રૂ. 14,00,000માં વેચ્યું હતું. આ મકાન તા. 1-1-86ના રોજ રૂ. 1,33,000માં ખરીદ્યું હતું. આ સિવાય તેમની અંગત માલિકીનું અન્ય કોઈ મકાન નહોતું. મકાન વેચાણની અમુક રકમનો ઉપયોગ તેમના પુત્રને વધુ અભ્યાસાર્થે પરદેશ મોકલવા અંગે કર્યો હતો અને બાકી રકમમાંથી તા. 31-12-13ના રોજ રહેઠાણ માટેનું બીજું મકાન રૂ. 6,00,000માં ખરીદ્યું હતું.

(2) તા. 1-5-84ના રોજ રૂ. 17,400માં ખરીદેલ અમુક સરકારી જામીનગીરીઓ તા. 31-12-2014ના રોજ રૂ. 2,03,175માં વેચી દીધી હતી અને તે પૈકી રૂ. 25,000ની રકમ તા. 1-2-2014ના રોજ NHAIના 3 વર્ષીય બોન્ડમાં રોકી દીધી હતી.

લાંબાગાળાના મૂડીનફાની ગણતરી માટેના સંબંધિત સૂચકાંક નીચે મુજબ છે :

નાણાકીય વર્ષ 1983-84	116
નાણાકીય વર્ષ 1985-86	133
નાણાકીય વર્ષ 2013-14	939

- 4 નીચે આપેલ માહિતી પરથી શ્રીમતી રેખાબેનની આ. વર્ષ 2014-15 માટે 10
અન્ય સાધનોની કરપાત્ર આવકની ગણતરી કરો :
- (1) રીડિમેબલ ડિબેન્ડ્સનું વ્યાજ (ટી.ડી.એસ.નો દર 10%)..... 7,200
 - (2) પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ 30,000
 - (3) જામીનગીરી પર વ્યાજ 5,000
 - (4) મ્યુ. કોર્પોના બોન્ડ્સ પરનું વ્યાજ 2,500
 - (5) વિદેશી સરકારી જામીનગીરી પર વ્યાજ..... 7,000
 - (6) ડિવિડન્ડ 700
- વ્યાજ વસૂલવા માટે તેમણે રૂ. 400 અને ડિવિડન્ડ વસૂલવા માટે રૂ. 1,000 બેંક કમિશન ચૂકવેલ હતું. શેરના ખરીદ વેચાણ અંગે દલાલીના રૂ. 400 ચૂકવેલ હતા.

અથવા

- 4 નીચે આપેલ માહિતી પરથી શ્રીમતી સોનાલીબેનની આ. વર્ષ 2014-15 માટે 10
અન્ય સાધનોની કરપાત્ર આવકની ગણતરી કરો :
- (1) રૂ. 80,000ના 10% "R" લિ.ના ડિબેન્ડ
 - (2) રૂ. 80,000ના 10% "S" લિ.ના ડિબેન્ડ (ટી.ડી.એસ. 10%)
 - (3) રૂ. 80,000ના 10% "G" લિ.ના કરમુક્ત ડિબેન્ડ
 - (4) રૂ. 80,000ના 10% NK લિ.ના કરમુક્ત ડિબેન્ડ (ટી.ડી.એસ. 20%)
 - (5) કરમુક્ત ડિબેન્ડનું વ્યાજ રૂ. 3,000.
 - (6) કરમુક્ત ડિબેન્ડનું વ્યાજ રૂ. 6,000 (ટી.ડી.એસ. 20%)
- કરમુક્ત ડિબેન્ડના વ્યાજ વસૂલવા માટે તેમણે રૂ. 800 બેંક કમિશન ચૂકવેલ હતું. અને ડિબેન્ડ ખરીદવા લીધેલ લોન પર રૂ. 500 વ્યાજ ચૂકવેલ હતું.

- 5 ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે) 10
- (1) સર્વિસ ટેક્ષ
 - (2) સમાધાન પંચ
 - (3) ગ્રોસિંગ અપ
 - (4) સી.બી.ટી.ડી. (C.B.D.T.)
 - (5) આકવેરા અધિકારી.

ENGLISH VERSION

- Instructions :**
- (1) Give answers of question no. 1 MCQ in answer book.
 - (2) Total five questions. All are compulsory.
 - (3) Figures to the right side indicate the marks.

1 M.C.Q. : 20

- (1) On which of the following values of the machine, depreciation should be calculated ?
 - (A) Written down value
 - (B) Purchase price
 - (C) Market value
 - (D) None of the above
- (2) Which of the following taxes is deductible from Business Income ?
 - (A) Professional Tax
 - (B) Income Tax
 - (C) Wealth Tax
 - (D) None of the above
- (3) Which of the following assets is not included in personal effects/articles ?
 - (A) Immovable assets
 - (B) Drawings/paintings
 - (C) Jewellery
 - (D) All the above articles
- (4) Transfer of which type of the following assets gives rise to capital gain ?
 - (A) Any Capital Asset
 - (B) Any Asset
 - (C) Land and Building
 - (D) Shares and Stocks
- (5) Long term capital gain is realized if shares of a company are transferred after
 - (A) 12 months of acquisition
 - (B) 18 months of acquisition
 - (C) 24 months of acquisition
 - (D) 36 months of acquisition

- (6) Dividend declared by company is
- (A) Fully taxable (B) Fully Tax Free
(C) Partly Tax Free (D) Deductible U/S 80 L
- (7) Under which head of following heads of income the interest earned by the dealer in securities would be considered ?
- (A) As Income from other sources
(B) As Business Income
(C) As Capital Gains
(D) None of the above
- (8) Rent received from a sub-tenant of house property would be treated as income from
- (A) Business Income
(B) Income from other sources
(C) House property Income
(D) None of the above
- (9) While making the payment of the lottery T.D.S. is to made at following rate :
- (A) 30% + Surcharge (B) 30%
(C) 30% + Education Cess (D) 31%
- (10) The deducter of tax at source from interest is required to issue the T.D.S. certificate in following prescribed form before the end of April of the relevant assessment year :
- (A) Form No. 15 (B) Form No. 16A
(C) Form No. 16 (D) Form No. 26
- (11) Which of the following Charge/Cess is to be deducted with tax while making the payment of interest to the Indian citizen ?
- (A) Surcharge (B) Higher Education Cess
(C) Education Cess (D) None

- (12) On how many services the service tax were imposed during first year ?
- (A) Zero (B) 1
(C) 2 (D) 3
- (13) Which of the following works may not be included in services ?
- (A) Stock broker (B) Telephone service
(C) General Insurance (D) A Provision Store
- (14) Service tax is which type of tax ?
- (A) Direct tax (B) Indirect tax
(C) Both of the above (D) None of the above
- (15) What is the Index number of 1978 considered ?
- (A) 80 (B) 90
(C) 100 (D) 711
- (16) Full form of T.D.S. is.....
- (A) Tax deduction and source
(B) Tax deduction at salary
(C) Tax deduction at source
(D) Tax detected at source
- (17) Which of the following amount is not deductible from business income ?
- (A) Interest on loan
(B) Interest on loan taken for purchase asset
(C) Interest on capital
(D) Interest on loan taken from friend
- (18) Transfer of which type of the following assets does not give rise to capital gain ?
- (A) Residential house (B) Share
(C) Bonds (D) Motorcar

(19) What percentage of service tax were taken in first year ?

- (A) 8% (B) 10%
(C) 12% (D) 5%

(20) What percentage of donation to Recognized institution is deductible as expenses in business-profession ?

- (A) 30% (B) 50%
(C) 100% (D) Not deductible

2 Shri Rajesh of Rajkot a well known advocate is 15
maintaining his accounts on cash basis. He furnishes the
following information for the year ended 31st March 2014 :

Receipts and Payments Account

Receipts	Rs.	Payments	Rs.
To Balance b/d	11,200	By Purchase - Office Equipments	24,000
To Professional fees :		By Motor car expenses	4,800
2011-12	500	By Office expenses	26,200
2012-13	1,000	By Staff salaries	45,100
2013-14	1,05,000	By Income tax paid	6,500
To Gifts from clients	800	By Interest on Loan	1,100
To Loan from clients	11,000	By Refund on Loan	15,000
		By Contribution to Provident Fund	650
		Balance C/F	6,150
	1,29,500		1,29,500

Additional Information :

- (1) Allowable depreciation on motor car is Rs 1,500.
(2) 20% of motor car expense is for personal use.

(3) Outstanding fees amount to Rs. 600.

(4) Calculate 10% depreciation on office equipments.

Compute taxable income of Rajesh under the head profits and gains of business or profession for the Assessment Year 2014-15.

OR

2 Shree Manish Talati has prepared the following Profit and Loss Account for the year ending 31st March 2014 :

Profit and Loss Account

Dr.		Cr.	
Particulars	Rs.	Particulars	Rs.
To General Expenses	6,500	By Gross Profit	1,63,200
To Bad-debts	200	By Discount and Commission	600
To Bad-debts Reserve	500	By Rent Income	2,700
To Provision for taxation	5,700	By Interest on Post office savings' Account	300
To Income Tax	8,500	By Bad debts recovered	1,600
To Insurance Premium	800	By surplus on sale of shares	7,500
To Motor car expenses (except depreciation)	10,500	Profit on sale of machinery (sold for Rs. 1,000)	100
To Sales Tax	5,500		
To Staff Salary	68,500		
To Legal charges	400		
To Donation to approved charitable trust	600		
To Net Profit	68,300		
	1,76,000		1,76,000

Additional Information is as follows :

- (1) Insurance premium includes Rs. 300 being Mediclaim insurance and Rs. 200 being Life Insurance Premium.
- (2) 25% of the amount of bad debts recovered relates to the amount of bad debts not allowed before three years.
- (3) 1/2 use of motor car is for personal purposes and the written down value of the car as on 1.4.2013 was Rs. 25,000 (Depreciation rate 15%)

Compute his total taxable business income for the Assessment Year 2014-15.

- 3** Compute the capital gains chargeable to tax of Shree Mahesh from the following for the A.Y. 2014-15. **15**
(Cost Inflation Index of 2013-14 is 939)

Sr. No.	Date of Purchase	Selling Price Rs.	Transfer Charges Rs.	Cost Rs.	Particulars of assets	Index of year of Purchase
1	1.1.68	30,70,000	9,000	3,00,000	Only self-occupied house	100
2	1.6.05	4,00,480	—	1,59,040	Shares of "R" Ltd.	497
3	1.3.94	1,97,000	6,000	73,200	Shares of "A" Ltd	244
4	1.9.85	28,90,100	11,000	3,99,000	Jewellery	133
5	1.1.13	—	—	2,02,000	Residential house for self occupation (new)	—

He had sold old self-occupied house on 15.3.2014.

The Cost Inflation Index of financial year 2013-14 is 939.

On 1.4.81 the fair market values of self-occupied house and jewellery were Rs. 3,00,000 and Rs. 1,80,000 respectively.

Shares of both the companies (sold on 1.11.13) were subject to securities transaction tax (STT).

OR

3 From the following particulars of Income of Shri Dinesh 15
determine his income under the head capital gain for the
Assessment Year 2014-15 :

- (1) Shri Dinesh had purchased a residential house for Rs. 1,33,000 on 1.1.86. He sold this house on 1.4.2013 for Rs. 14,00,000. This was the only house owned by him. A part of the sale proceeds was utilized by him for the education of his son and Rs. 6,00,000 was used on 31.12.2013 to acquire another residential house.
- (2) On 31.12.2014, he sold some of the securities for Rs. 2,03,175 which were purchased by him on 1.5.84 for 17,400. Rs. 25,000 of the sales price was invested on 1.2.14 in 3 year Bonds of NHAI.

Relevant Cost Index for long term capital gain are as follows :

P.Y. 1983-84	116
P.Y. 1985-86	133
P.Y. 2013-14	939

4 From the information given below calculate the taxable 10
income from other sources of Shrimati Rekha for A.Y.
2014-15 :

- | | |
|---|------------|
| (1) Interest on redeemable debentures | Rs. |
| (T.D.S. rate 10%) | 7,200 |
| (2) Preference share dividend..... | 30,000 |
| (3) Interest on securities | 5,000 |
| (4) Interest on Municipal Corporation Bonds | 2,500 |
| (5) Interest on foreign government securities | 7,000 |
| (6) Dividend | 700 |

She paid Rs. 400 for collecting interest and Rs. 1,000 for collecting dividend as bank commission, paid Rs. 400 commission for purchase and sales of shares.

OR

4 From the information given below, calculate the taxable **10**
income from other sources of Shrimati Sonali for A.Y. 2014-15.

- (1) Rs. 80,000 – 10% debenture of "R" Ltd.
- (2) Rs. 80,000 – 10% debenture of "S" Ltd. (T.D.S. 10%)
- (3) Rs. 80,000 – 10% tax free debenture of "G" Ltd.
- (4) Rs. 80,000 – 10% tax free debenture of NK Ltd.
(T.D.S. 20%)
- (5) Interest on Tax Free debenture - Rs. 3,000
- (6) Interest on Tax Free debenture Rs. 6,000 (TDS 20%)

She paid bank commission Rs. 800 for collecting interest on tax-free debentures and Rs. 500 for interest on loan taken for purchase of debenture.

5 Write short notes : (any two) **10**

- (1) Service tax
- (2) Settlement commission
- (3) Grossing up
- (4) C.B.D.T.
- (5) Income Tax Officer.
